



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૩/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૩૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૧૦ કેસ કરી, ૧૯૬ વ્યક્તિઓને ઝડપી, ૩૪૧૫ લીટર દેશી દારૂ, ૩૪૩ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૪૫ બીયરટીન, ૦૨ સ્ક્રટર અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧૩ કેસ કરી ૪૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૯,૧૨૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૩૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૪૩૭/૧૯

વસ્ત્રાપુર : પ્રદીપભાઈ પોપટલાલ શાહ (ઉ.વ.૪૯)(રહે.પહેલા માળે, યશ કોમ્પલેક્ષ, પેઝવન હોટલની બાજુમા વસ્ત્રાપુર) એ તા.૭/૩/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૩/૨૦૧૯ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન બોડકદેવ દેવઆશીષ બિઝનેસ પાર્કની બાજુમા, કિશ્ના કોમ્પલેક્ષ ખાતે આરોપી ઇર્ષાદ અઝમેરી (રહે,ફિરદોશ ફ્લેટ, બી.એમ.સી બેંકની પાસે, ખાનપુર) એ પ્રદિપભાઈ પાસેથી તેમની ગાડી નંબર જીજે.૦૯.એમ.૬૯૯૪ કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- તેમજ કોમ્પ્યુટરનુ માહે ફબ્રુઆરી નું ભાડુ રૂપિયા ૭,૫૦૦/- તથા ટિકિટ પેટે આપેલ રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૨૨,૫૦૦/- ની મતા પ્રદિપભાઈને પરત નહી આપી, પ્રદિપભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.વી.વાલાણી ચલાવે છે.

ઘાટલોડીયા : હિરલબહેન માધુભાઈ પટેલ (ઉ.વ.૩૫)(રહે.ન્યુ સુર્યનારાયણ સોસાયટી વિ-૧ પારસમણી ફ્લેટની બાજુમાં રન્નાપાર્ક ઘાટલોડીયા) એ તા.૭/૩/૧૯ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૭/૨૦૧૮ બપોરના ૪/૦૦ થી તા.૧૨/૨/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે આરોપી મીહીરભાઈ ભરવાડ (રહે. ભરવાડ વાસ ગોપાલ ચોક નવા વાડજ) એ હિરલબહેન ને ઔડાનું મકાન અપાવવાની લાલચ આપી, તેમની પાસેથી રૂપિયા ૪,૦૪,૦૦૦/- મેળવી લઈ, મકાન નહી આપી તેમજ રૂપિયા પરત નહી કરી, હિરલબહેન સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.આર.ગામીત ચલાવે છે.

સેટેલાઈટ : દુષ્ચંતભાઈ જીતેન્દ્રભાઈ બારોટ (ઉ.વ.૩૮)(રહે.કૃષ્ણધામ સોસાયટી સ્વામીનારાયણ મંદીરની પાછળ ઇંડીયા કોલોની ટોલનાકા બાપુનગર) એ તા.૭/૩/૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને-૨૦૧૭ થી સને-૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન સેટેલાઈટ ઉમીયા વિજય કોમ્પલેક્ષમાં ઓફીસ નંબર-૩૦૪ ખાતે આવેલ “સ્વધાર ફીનવર્સ પ્રા.લી.” નામની દુષ્ચંતભાઈની કંપની ની ઓફીસ ખાતે કામ કરતા કર્મચારીઓ (૧) પદમેશ કમલેશભાઈ મોદી (રહે.આર/૫૧૩ સેક્ટર ચાણ્ક્યપુરી ઘાટલોડીયા (૨) હસમુખકુમાર ઠાકોર (રહે.પુર્ણ પુરુષોત્તમ નગર વિભાગ-૦૧ આદર્શ વિધ્યાલય પાછળ અરૂણ આશ્રમ પાસે રાણીપ) (૩)મનીષ રાજપાલ (રહે. જગજીવન સોસાયટી શારદાબેન હોસ્પિટલ પાસે સરસપુર) અને (૪) નિરજ રામી (રહે.દેવરાજ રેસીડેંસી નિકોલ રોડ નરોડા)નાઓએ ભેગામળી અલગ-અલગ મહીલાઓ પાસેથી કંપનીએ આપેલ લોન પેટેના નાણા કુલ રૂપિયા ૭,૮૫,૨૨૭/- મહીલાઓ પાસેથી ઉઘરાવી તે નાણા કંપનીમાં જમા નહી કરાવી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.ગમારા ચલાવે છે.

સોનાનું મંગળસુત્ર ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૪૩૮/૧૯

સોલા હાઇકોર્ટ : લતાબહેન અનીલકુમાર તલસાણીયા (રહે.સ્વર્ણીમ હેઝા હોટેલની બાજુમાં ગોતા) તા.૦૭/૦૩/૨૦૧૯ સાંજના ૬/૧૫ વાગ્યા ના સુમારે ગોતા ગાર્ડન વ્યુ બંગ્લોઝ આગળ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ લતાબહેન ના ગળામાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૨૩,૦૦૦/- મતાનું ખેંચી તોડી લઈ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ લતાબહેન તલસાણીયા એ સોલા હાઇકોર્ટ ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી તારીકમહંમદ સીકંદરભાઈ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૪૩૮/૧૯

ઈસનપુર : અબ્દુલમુઇસ મકબુલઅહેમદ સગરી (ઉ.વ.૨૯)(રહે.ગામ-રંગમપેડ ધુલપેડ મહોલ્લો તા.-સુરપુર પોલીસ થાણુ-સુરપુર જી.-યાદગીર કર્ણાટકા) એ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૦૩/૨૦૧૯ બપોરના ૧/૦૦ થી ૧/૧૫ વાગ્યા દરમ્યાન નારોલ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ થી ઈસનપુર ચાર રસ્તા સુધીની બી.આર.ટી.એસ. બસની મુસાફરી દરમ્યાન બસમાં ભીડનો લાભ લઈ કોઈ અજાણી વ્યક્તિ એ અબ્દુલમુઇસ ની નજર ચુકવી ખિસ્સામાં રાખેલ રોકડ રૂપિયા ૯૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એન.ભરવાડ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.